



જનસંપર્ક અધીકારી દ્વારા

પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર

ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૨૭/૦૬/૨૦૧૯ ગુરુવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૦૮૪/૧૯

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૧૧૩ કેસ કરી, ૯૭ વ્યક્તિઓને ઝડપી, ૩૩૦ લીટર દેશી દારૂ, ૩૭૯ બોટલ ઈંગ્લીશ દારૂ, ૧૦૭ ક્વાર્ટર ઈંગ્લીશ દારૂ, ૨૩ બિયર ટીન, ૨ કાર, ૧ સ્ફૂટર અને ૧ મોટર સાયકલ કબજે કર્યું હતું. તેમજ જુગાર ધારા હેઠળ ૪ કેસ કરી ૧૬ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૬૭,૩૭૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૦૮૫/૧૯

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૨૧૮ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી ૯૩ મુજબ ૧૩ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૫ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

ચોરી:-

સમાચાર યાદી નં.૧૦૮૬/૧૯

નારોલ: સોપાન તાતીયાબા લાંબતુરે (રહે. રેણુકા નીવાસ બદ્રીપ્રસાદની ચાલી સીતારામ ફ્લેટ પાસે ઉત્તમનગર મણીનગર) એ નારોલ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૫/૬/૧૯ સાજના ૭/૩૦ થી તા.૨૬/૬/૧૯ સાજના ૭/૩૦ વાગ્યા દરમિયાન નારોલ વૈશાલીનગર ખાતે આવેલ શ્રી રામ એસ્ટેટ-૦૨ માં અંબીકા સાઇનફેબ પ્રા.લી નામના ગોડાઉન નં.૮,૯ ના કંપાઉન્ડમાંથી કંપનીની કાપડની ગાંસડીઓમાં નંગ-૧૩ કિમત રૂપિયા ૧,૮૦,૦૦૦/- અજાણી વ્યક્તિ ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી ટી.કે.દેવમુરારી ચલાવે છે.

સોનાનો દોરો ખેચી તોડી લઈ ગયા:-

સમાચાર યાદી નં.૧૦૮૭/૧૯

વસ્ત્રાપુર: શુશીલાબહેન વા/ઓફ બ્રીજમોહન માલપાણી (ઉ.વ.૬૪) (રહે. બંગલા નં-૭ ન્યુ રાજદીપ સોસાયટી સુર્યદીપ ટાવર સામે નરોડા નાગરીક બેંકની ગલીમા ગુરુકુળ મેમનગર) તા.૨૬/૬/૧૯ સાજના ૫/૧૫ વાગ્યાના સુમારે મેમનગર ગુરુકુળ રોડ યુ કો બેંકની બાજુમા નવનીત પ્રેસ સામેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક મોટર સાયકલ ઉપર આવેલ બે પુરૂષ શુશીલાબહેનના ગળામાંથી સોનાનો દોરો પેડલ સાથે કિમત રૂપિયા ૧૦,૦૦૦/- ખેચી તોડી લઈ નાસી ગયા હતા. આ અંગેની ફરીયાદ શુશીલાબહેન માલપાણીએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી ડી.વી.વાલાણી ચલાવે છે.

ગુજરાત યુનિવર્સિટી: મંગ્લેશ જીતેન્દ્ર કુમાર તાતેડ (ઉ.વ.૩૯) (રહે. અભિનંદન એપાર્ટમેન્ટ સંત કબીર સ્કુલ સામે નારણપુરા) એ અગમ્ય કારણસર તા.૨૬/૬/૧૯ સવારના ૧૦/૦૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે વધુ પડતી દવાની ગોળીઓ ખાઈ લેતા તેમનું મૃત્યુ નિપજયું હતું. આ અંગે ગુજરાત યુનિવર્સિટી પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઇ.શ્રી કે.કે.ચૌધરી ચલાવે છે.

વેજલપુર: અબ્દુલભાઈ કાસમભાઈ સમા (ઉ.વ.૩૬) (રહે. નુર મોહમદ પાર્ક નળ સરોવર વસાહત કાજી મસ્જીદ પાસે ફતેવાડી સરખેજ રોડ) એ અગમ્ય કારણસર તા.૨૬/૬/૧૯ કલાક ૧૧/૩૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે ઝેરી દવા પી લીધી હતી. સારવાર માટે એસ.વી.પી.હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નિપજયું હતું. આ અંગે વેજલપુર પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ મ.સ.ઇ.શ્રી શૈલેષભાઈ ધીરુભાઈ ચલાવે છે.

કૃષ્ણનગર: મુકેશસિંહ સ/ઓ બળવંતસિંહ ઝાલા (ઉ.વ.૩૦) (રહે. રમેશવિહાર સોસાયટી બજરંગ આશ્રમ પાછળ કૃષ્ણનગર) એ અગમ્ય કારણસર તા.૨૫/૬/૧૯ રાતના ૧૧/૨૫ વાગ્યાના સુમારે પોતાના ઘરે પંખાના હુકમાં દુપટ્ટો બાંધી ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે કૃષ્ણનગર પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી કેશાભાઈ બબાભાઈ ચલાવે છે.

કાગડાપીઠ: કલ્પનાબહેન ડો/ઓફ ભગવાનદાસ સુર્યવંસી (ઉ.વ.૪૫) (રહે. તારાચંદ ગાંધીની ચાલી કેલીકો મીલ ગેટ નં-૬ સામે બહેરામપુરા) એ અગમ્ય કારણસર તા.૨૬/૬/૧૯ કલાક ૮/૩૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે ઝેરી ગોળીઓ ખાઈ લીધી હતી. સારવાર માટે એસ.વી.પી.હોસ્પિટલ ખાતે લઈ જતા ફરજ પરના ડૉ.શ્રીએ મૃત જાહેર કર્યા હતા. આ અંગે કાગડાપીઠ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઇ.શ્રી એમ.બી.પટેલ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.